

તમાકુની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિનો અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો

આણંદ કૃષિ યુનિવર્સિટીના બીડી તમાકુ સંશોધન કેન્દ્ર અને નાઇસોલ મેન્યુફેક્ચરિંગ ક્વા.ના સહયોગથી તા.૧૨/૦૯/૨૦૨૨ના રોજ તમાકુની ખેતી કરતા ખેડૂતોને લાભ થાય તે માટે ડૉ. કે. બી. કથીરીયા, માન. કુલપતિશ્રી, આણંદ કૃષિ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ એક તાલીમ કાર્યક્રમનું સફળતા પૂર્વક આયોજન થયેલ હતું.

સમારંભની શરૂઆત શ્રી ગણપતી સ્તુતી તથા દિપ પ્રાગટ્યથી યુનિવર્સિટીના મહાનુભવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. સમારંભની શરૂઆતમાં ડૉ. જે.એન.પટેલ સંશોધન વૈજ્ઞાનિક અને યુનિટ વડા, બીટીઆરએસ દ્વારા સર્વેનું કુલથી સ્વાગત ત્યારબાદ શાબ્દિક સ્વાગત તેમજ પ્રસંગોચિત ઉદ્બોધન અને તાલીમની રૂપરેખાની માહિતી આપી. નાઇસોલ ક્વા તરફથી શ્રી પીન્દુભાઈ રાઠોડ એ જણાવ્યું કે નાઇસોલ કંપની ખેડૂતોના ઉત્થાન માટે તેમજ તેમના હિતાર્થ માટે કામ કરી રહી છે. માનનીય ડૉ. એમ. કે. ઝાલા, સંશોધન નિયામકશ્રીએ જણાવ્યું કે મધ્ય ગુજરાતમાં તમાકુ એ મુખ્ય પાક છે અને તેનો વૈકલ્પિક ઉપયોગ તરીકે નિકોટીન સલ્ફેટ છે જે નિકાસ થતી ઉત્પાદક વસ્તુ છે જે તથા તેનો ઉપયોગ દવા બનાવવામાં થાય છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના મા. કુલપતિ ડૉ. કે.બી.કથીરીયા સાહેબે જણાવ્યું કે આ પ્રકારના તાલીમ કાર્યક્રમ દ્વારા ખેડૂતોને લાભ થાય અને પ્રાઇવેટ સેક્ટર યુનિવર્સિટી સાથે સંનિષ્ઠ રીતે જોડાઇ ખેડૂતોના હિતમાં કામ કરે તે જરૂરી છે. નાઇસોલ મેન્યુફેક્ચરિંગ ક્વા ફક્ત આવક મેળવવા માટે નહિ પરંતુ ખેડૂત માટે સુખાકારી અને તેનું હિત જાળવી કાર્ય કરે છે જે સરાહનીય છે.

આખા દિવસ દરમિયાન તમાકુ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રીઓએ તમાકુની જાતો, પાક વ્યવસ્થા, પાકમાં આવતા રોગ-જીવાત અને તેના ઉપાય, મ્યૂઝીયમ અને ગ્લાસ હાઉસ તેમજ નર્સરી અને ફીલ્ડની ખેડૂતોની પ્રત્યક્ષ મુલાકાત કરાવવામાં આવી હતી. તેમજ નર્સરી પર બોર્ડો મિશ્રણ પ્રત્યક્ષ બનાવી પ્રાયોગિક પધ્ધતિ શીખવવામાં આવી હતી.

આ તાલીમના અંતે સર્વે તાલીમાર્થીઓએ તેમના અભિપ્રાય તેમજ પ્રતિભાવો રજૂ કરેલ અને તેમનો આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતી કરવામાં આવી. ઉપરોક્ત તાલીમમાં ૧૦૦ ખેડૂત તાલીમાર્થીઓએ ભાગ લીધેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બીડી તમાકુ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રીઓ તથા કર્મચારીઓ દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવેલ હતું.

